

CRESTCHEM LIMITED

Reg. office: Sr. No. 550/1, Sub Plot o. 12, Village Indrad, Taluka -Kadi, District- Mehsana, Pin code-382715, Gujarat.
Phone : +91-9409119484, Email : info @crestchemlimited.in GST Number : 24AAACC8722C1Z5
CIN NO. L24100GJ1991PLC015530/WEBSITE : www.crestchemlimited.in

11/11/2020

To,

The Bombay Stock Exchange Ltd.
The Department of Corporate Services,
PhirozJeejeebhoy Tower,
Dalal Street,
Mumbai -400001

BSE Code - 526269


Dear Sir,

Sub. : Announcement under Regulation 30 (LODR) – News Paper Publication

With regard to captioned subject, we enclosed herewith copy of e-newspaper of Extract of Unaudited Standalone Financial Results of the company for the quarter ended September 30, 2020 which has been published on Lokmitra Gujarati (Gujarati News paper) and Freepress Gujarat (English Newspaper) November 11,2020

Yours Truly

For Crestchem Limited


Khyat Vyas
Company Secretary

ADINATH EXIM RESOURCES LIMITED

12A 3rd Floor, Abhinav Corporate Park, Ambli Bopal Road, Ambli, Ahmedabad - 380058, Gujarat
Ph: 079-25230781, Fax: 079-25230782, E-mail: info@adinathexim.com
Website: www.adinatheximresources.com, CIN: L65100G11995PLC024300

EXTRACT OF STANDALONE AUDITED FINANCIAL RESULTS FOR THE QUARTER AND SIX MONTHS ENDED ON SEPTEMBER 30, 2020
(Rs. In Lacs except Per share data)

Sr. No.	Particulars	Quarter ended on	
		30.09.2020	30.09.2019
		(Un-Audited)	(Un-Audited)
1	Total Income from Operations (Net)	23.77	30.35
2	Net Profit / (Loss) for the period (before Tax, Exceptional Items)	16.79	23.99
3	Net Profit / (Loss) for the period before tax (after Exceptional Items)	18.79	23.99
4	Net Profit / (Loss) for the period after tax (after Exceptional Items)	14.21	22.34
Total Comprehensive Income for the period (Comprising Profit / (Loss) for the period (after tax) and Other Comprehensive Income (after tax))		0.11	357.15
6	Equity Share Capital	481.91	481.91
7	Reserve (Including Revaluation Reserve as shown in the Balance Sheet of Previous Year)	0.00	0.00
Earnings Per Share (for continuing and discontinued operations) (Face Value of Rs.10/- each)			
(a) Basic:		0.33	0.52
(b) Diluted:		0.33	0.52

The above is an extract of the detailed format of Un-Audited Financial Results for the Quarter ended on June 30, 2020 filed with Stock Exchange under Regulation 33 of SEBI (Listing Obligations and Disclosures Requirements) Regulations, 2015. The full format of Un-audited financial results of the Company for the Quarter and six months ended on September 30, 2020 are available on the Company's website www.adinatheximresources.com and website of the Stock Exchange www.bseindia.com

For, ADINATH EXIM RESOURCES LIMITED
Sd/-
Manoj S. Salva
Managing Director
DIN: 01529306

Date: 10.11.2020

Place: Ahmedabad

Hawa Engineers Ltd

Registered office : Plot No. 129, Narol Road, Near Kasliaram Textile Mill, Ahmedabad, Gujarat, 382405
II Phone : 079-25230781, 25230782 II CIN : L29120G11993PLC019199 II

EXTRACT OF STANDALONE UNAUDITED FINANCIAL RESULTS FOR THE QUARTER AND HALF YEAR ENDED 28-09-2020
(Rs. in Lakh except per share data)

Sr. No.	Particulars	Quarter ended		
		30-09-2020	30-09-2019	30-09-2019
		(Unaudited)	(Unaudited)	(Unaudited)
1	Total Income from operations (net)	109.56	174.59	198.53
2	Net Profit/(Loss) for the period (before Tax, Exceptional and/or Extraordinary Items)	42.59	46.35	33.60
3	Net Profit/(Loss) for the period before tax (after Exceptional and/or Extraordinary Items)	31.56	35.75	33.60
4	Net Profit/(Loss) for the period after tax (after Exceptional and/or Extraordinary Items)	31.56	35.75	33.60
5	Total Comprehensive Income for the Period (Comprising Profit/(Loss) for the period (after tax) and Other Comprehensive Income (after tax))	32.64	32.64	32.64
6	Equity Shares Capital	0.00	0.00	0.00
7	Other Equity (Including Revaluation Reserve)	0.00	0.00	0.00
Earnings Per Share (of Rs. 10/- each) (not annualised)				
(a) Basic:		0.89	1.01	0.95

The above results have been reviewed by the audit committee of the Company and taken on record by the Board of Directors of the Company in its meeting held on 10/11/2020 and same are also reviewed by the statutory auditors of the Company.

For, Hawa Engineers Ltd
Sd/-
Aslam F. Kaggi
Managing Director
DIN: 0006879

Place : Ahmedabad

Date : 10th November, 2020

Himachal to go Haryana way on job quota for local youngsters

Chandigarh, Close on the heels of the BJP-JJP government passing a Bill for 75% quota in the private sector for Haryanvi youngsters, the Himachal Pradesh government is considering introducing a legislation to provide 70% jobs for locals. "We are studying what Haryana has done to see if a similar law can be implemented in Himachal Pradesh," said state labour commissioner-cum-director of employment

Neeraj Kumar. Unemployment is a major job issue in Himachal, which ranks fourth among states with the highest unemployment rate in the country, and parties, including the BJP, promised maximum jobs to Himachalis in the run-up to the 2017 assembly elections. The BJP's Vision Document promised to "stirly implement the criteria of 70% jobs to Himachal youth in the industry" according to the Centre's Monitoring Indian

Economy (CMIE), a thinktank, Himachal Pradesh's unemployment rate in October was 13.5%. Haryana was still at the top at 27.3%, followed by Rajasthan at 24.1% and Jammu and Kashmir at 16.1%. The national average is 6.6%. Kumar says the problem in Himachal Pradesh is the high salary expectations among youngsters, who prefer white collar jobs to working in industries and prefer heading out of the

state for better pay. Himachal Chapter of Confederation of Indian Industry (CII) chairman T Col Shailesh Pathak (retd) says as a result, the state has a dearth of local skilled labour and the industry is forced to hire labour from other states. "The demand for industrial jobs is not much here (in Himachal Pradesh). We overcome the shortfall in labour by hiring from other states," he says. He said the CII holds recruitment camps across the state.

PADMANABH INDUSTRIES LIMITED

(CIN: L3710G11994PLC023396)
Regd. Office: 401, Abhinav Avenue, Opp. Hanuman Temple, Nehrunagar Circle, Ambawadi Ahmedabad 380015.
PHONE-91 7926400200.
EMAIL: padmanabhindustries@gmail.com
Website: www.padmanabhindustries.com

NOTICE TO THE SHAREHOLDERS OF 26TH ANNUAL GENERAL MEETING (AGM) of the Company will be held on Monday, December 28, 2020 at 03:30 p.m. through Video Conference ("VC")/Other Audio Visual Means ("OAVM") to transact the business as set out in the Notice of AGM which is being circulated to the shareholders of the Company. In view of the continuing COVID-19 pandemic, the Government of India Ministry of Corporate Affairs, vide its Circular No. 14/2020 dated May 8, 2020, Circular No. 17/2020 dated April 13, 2020 and Circular No. 18/2020 dated May 5, 2020 and also Securities Exchange Board of India, vide its circular No. SEBI/HO/CFD/CMD/ICIR/P/2020 dated May 12, 2020 ("Circular"), have permitted the holding of AGM through VC/OAVM, without the physical presence of the Members at a common venue in compliance with these circular and the relevant provisions of the Companies Act, 2013 and the SEBI (Listing Obligations and Disclosure Requirements) Regulations, 2015, the AGM of the Members of the Company will be held through VC/OAVM.

In accordance with the aforesaid Circulars, Notice of the AGM along with the Annual Report 2019-20 are being sent up by electronic mode to those Members whose e-mail addresses are registered with the Company/Depositories. Members may note that the Notice of AGM and Annual Report 2019-20 will also be available on the Company's Website www.padmanabhindustries.com and on website of the Stock Exchanges i.e. Bombay Stock Exchange of India Limited at www.bseindia.com respectively and the AGM Notice is also available on the website of CDSL (agency for providing the Remote e-Voting facility) i.e. www.evotingindia.com. Members can attend and participate in the AGM through the VC/OAVM facility only. The instructions for joining the AGM are provided in the Notice of the AGM. Members attending the meeting through VC/OAVM shall be entitled for the purpose of reckoning the quorum as per Section 103 of the Companies Act, 2013.

The Company is providing remote e-voting facility ("remote e-voting") to all its members to cast their votes on all resolutions as set out in the Notice of AGM. Additionally, the Company is providing the facility of voting through e-voting system during the AGM ("e-voting"). Detailed procedure for remote e-voting/e-voting is provided in the Notice of the AGM.

In case of Member(s) who have not registered their e-mail addresses with the Company, they are requested to please follow the below instructions to register their e-mail address for obtaining Annual Report and login details for e-voting.

a. For members holding shares in Physical mode please provide necessary details like Folio No. Name of shareholder by email to padmanabhindustries@gmail.com.

b. Members holding shares in Demat mode can get their E-mail ID registered by contacting their respective Depository Participant or by email to padmanabhindustries@gmail.com and e-voting manual available at www.evotingindia.com. Under help section or write an email to helpdesk.evoting@cdslindia.com or call 022-23095942/43.

All grievance connected with the facility for voting by electronic means may be addressed to M. Rakesh Datta, Manager, Central Depository Services (India) Limited, A Wing, 25th Floor, Marathon Futures, Mafatal Mill Compound, N M Joshi Marg, Lower Parel (East), Mumbai - 400013 or send an email to helpdesk.evoting@cdslindia.com or call 022-23095942/43.

By order of the Board
For, PADMANABH INDUSTRIES LIMITED
Sd/-
Chairman Cum Managing Director
DIN: 03129204

Place: Ahmedabad

Date: November 10, 2020

CRESTCHEM LIMITED

(CIN: L24100G11991PLC015530)
Regn Office Address: Sr No 550/1, Sub Plot No. 12, Village- Indrad, Taluka- Kadi, Mahesana- 382715

UN-AUDITED FINANCIAL RESULTS FOR THE QUARTER ENDED 30TH SEPT, 2020 (Rs in Lacs)

Sr. No.	Particulars	STANDALONE FINANCIALS		Half Year Ended	
		30.09.2020	30.09.2019	30.09.2020	30.09.2019
		(Un-audited)	(Un-audited)	(Un-audited)	(Un-audited)
1	Income	240.23	150.00	390.29	620.45
	Revenue from operations	240.23	150.00	390.29	620.45
	Other Operating Income	0.00	0.00	0.00	0.00
	(a) Total Income from Operations (net)	240.23	150.00	390.29	620.45
	(b) Other Income	1.36	1.14	2.50	2.50
	Total Income (net)	241.59	151.14	392.79	622.95
2	Expenses	187.37	116.14	303.31	488.77
	(a) Cost of Materials Consumed	0.00	0.00	0.00	0.00
	(b) Purchase of Stock-in-Trade	0.00	0.00	0.00	0.00
	(c) Changes in Inventories of Finished Goods, Work-in-Progress and Stock-in-Trade	0.00	0.00	0.00	0.00
	(d) Excise duty on Sales	6.84	3.25	3.02	12.92
	(e) Employee benefits expense	0.38	0.15	0.20	0.54
	(f) Finance Costs	0.67	0.37	1.04	2.09
	(g) Depreciation & amortisation expenses	16.73	22.76	6.39	42.49
	(h) Other Expenses	23.54	142.89	124.20	356.92
	Total Expenses (after depreciation)	27.75	8.52	36.27	56.99
3	Profit before Tax (1-2)	53.82	34.88	86.48	55.46
4	Tax Expenses	2.22	2.26	1.87	4.83
	(i) Current Tax	2.22	2.26	1.87	4.83
	(ii) Deferred Tax	0.00	0.00	0.00	0.00
	Total Tax (1-4)	2.22	2.26	1.87	4.83
5	Profit for the period (1-4)	51.60	32.62	84.61	50.63
6	Non Controlling Interest	0.00	0.00	0.00	0.00
7	Net Profit after Non Controlling Interest (1-5)	(2.86)	(2.86)	(2.86)	(2.86)
8	Other Comprehensive Income for the period (5+6)	20.50	3.89	17.90	44.38
	(Comprising Profit/(Loss) and Other Comprehensive Income for the period)	20.50	3.89	17.90	44.38
9	Earnings Per Equity Share (Face Value of 10)	300.00	300.00	300.00	300.00
	(a) Basic	300.00	300.00	300.00	300.00
	(b) Diluted	300.00	300.00	300.00	300.00

(I) The Financial Results have been prepared in accordance with Indian Accounting Standards (Ind AS) as notified under section 133 of Companies Act, 2013 read with Rule 3, of the Companies (Indian Accounting Standards) Rule 2015 and Relevant Amendments thereunder.

(II) The above Unaudited Financial Results for the Quarter ended September 30, 2020 have been reviewed by the audit committee and were taken on record by the Board of Directors in their respective meetings held on 10th November, 2020 and a Limited Review of the same has been carried out by the Statutory Auditors of the Company.

(III) The Statutory Auditors of the Company have carried out a "Limited Review" of the above results as per Regulations 33 of SEBI (Listing Obligations and Disclosure Requirements) Regulations, 2015.

(IV) The Company operates only in one segment viz. Industrial Chemicals.

(V) The Company operates globally and in India, the company's management has made initial assessment of likely adverse impact on business and financial risks, and believes that the impact is likely to be short term in nature. The management does not see any medium to long term risks in the company's ability to continue as a going concern. The management does not see any medium to long term risks in the company's ability to continue as a going concern. The management does not see any medium to long term risks in the company's ability to continue as a going concern. The management does not see any medium to long term risks in the company's ability to continue as a going concern.

(VI) Figures for the previous period have been regrouped, reclassified and restated wherever necessary to make them comparable with the current period's figures.

By Order of Board of Directors
For Crestchem Limited
Sd/-
Managing Director
(DIN: 02052080)

Place: Indrad, Kadi

Date: 10th November, 2020

KINTECH RENEWABLES LIMITED

Regd. Off.: Kintech House, 8, Shivoliik Plaza, Opp. AMA, IIM Road, Ahmedabad - 380 015, Gujarat.
Tel. No: (079) 26303064; E-mail: cs@kintechrenewables.com, Website: www.kintechrenewables.com, CIN: L40105G11985PLC013254

EXTRACT OF UNAUDITED FINANCIAL RESULTS FOR THE SECOND QUARTER AND HALF YEAR ENDED ON 30TH SEPTEMBER, 2020
(Rs in Lakhs except earning per share data)

Sr.No.	Particulars	Quarter ended		
		30th September, 2020	30th September, 2020	30th September, 2019
		Unaudited	Unaudited	Unaudited
1	Total Income from Operations	21.88	90.71	35.17
2	Net Profit / (Loss) for the period (before Tax, Exceptional items)	12.13	15.93	29.13
3	Net Profit / (Loss) for the period before tax (after Exceptional items)	12.13	15.93	29.13
4	Net Profit / (Loss) for the period after tax (after Exceptional items)	9.23	12.03	22.22
5	Total Comprehensive Income for the period [(Comprising Profit / (Loss) for the period (after Tax) and Other Comprehensive Income (after Tax)]	9.23	12.03	22.22
6	Equity Share Capital (of Rs.10/- each)	100.00	100.00	100.00
7	Earnings Per Share of Rs 10/- each (For Continuing Operations- Not Annualised) (In Rs.)			
	1. Basic	0.92	1.20	2.22
	2. Diluted	0.92	1.20	2.22

(1) The above results have been reviewed by the Audit Committee and approved by the Board of Directors at their meeting held on 10th November, 2020.

(2) The Figures for the previous year / period have been regrouped / reclassified wherever necessary to correspond with the current period's classification / disclosure.

(3) The above is an extract of the detailed format of Quarterly/ Half Yearly Un-audited Financial Results Filed with the Stock Exchange under Regulation 33 of the SEBI (Listing Obligations and Disclosure Requirements) Regulations, 2015. The full format of the Quarterly/ Half Yearly Un-audited financial results is available on the website of Stock Exchange, www.bseindia.com and on the website of the Company at www.kintechrenewables.com.

(4) The Statutory Auditors of the Company have carried out a "Limited Review" of the Company for the aforesaid Un-audited Financial Results for the quarter and half year ended as on 30 September, 2020 in terms of Regulation 33 of SEBI (Listing Obligations and Disclosure Requirements) Regulations, 2015 and have expressed their unmodified opinion.

For and on behalf of Board of Directors of Kintech Renewables Limited
Sd/-
Piyush Shah
Managing Director
(DIN: 00385460)

Place : Ahmedabad

Date : November 10, 2020

FEDERAL BANK

Ref No. BBVO/SRT/SALE/2020-21 Dated 07/11/2020
POSSESSION NOTICE

Sale Notice for Sale of Immovable Assets Under the Securitisation and Reconstruction of Financial Assets and Enforcement of Security Interest Act, 2002 read with proviso to Rule 6 (5) of the Security Interest

Notice is hereby given to the public in general and in particular to the borrowers and Guarantors that the below described immovable property mortgaged / charged to the Federal Bank Ltd (Secured Creditor), the physical possession of which has been taken by the Authorized Officer of the Federal Bank Ltd (Secured Creditor) will be sold on "As is where is", "As is what is", and "Whatever there is" on 27th November, 2020, for recovery of Rs 3,45,49,173.00 (Rupees Three Crore Forty Five Lakh Forty Nine Thousand and One Hundred Seventy Three Only) due to sale from 1) Mr. Manoj Rupnarayan Upadhyay (proprietor of Sri Balaji Logistics), 2) Mrs. Manjulaben Manojbal Upadhyay and 3) Mr. Ajaykumar Rupnarayan Upadhyay all residing at A/11, Narayan Dharm Nagar, Khodiyar Char Rasta, New VIP road, Vadodra, 390019. The Reserve price will be Rs. 14,50,000.00 (Rupees Fourteen Lakh Fifty Thousand Only) and the earnest money deposit will be Rs. 1,45,000.00 (Rupees One Lakh Forty Five Thousand Only).

Description of the Immovable Property
All the piece and parcel of the residential flat No A-11, addressing 37.74 sq meters along with proportionate undivided common land measuring 22.49 sq. meter, totaling 76.99 sq. meter, having construction measuring 22.545 sq. meter thereon in the scheme known as Narayanam Society located on the land bearing R.S. No. 283/Pak, C.S No 157/Pak, Mouje Sayajipura, Taluka and Dist. Vadodra, and bounded on the North by Block No A-18 having margin space, on the East by Block No A-19, on the South by 6 mt road bearing margin space, on the South by 6 mt road bearing margin space.

For, The Federal Bank Ltd,
Authorized Officer
Loan Collection & Recovery Department
Mumbai Division
(Authorized Officer under SARFAESI Act)
The Federal Bank Ltd., Loan Collection & Recovery Department / Mumbai Division, 134, 12th Floor, Jolly Maker Chambers II, Nariman Point, Mumbai 400 021. E-mail: mumbai@federalbank.co.in
(Phone: 022 - 22022545, 22028427)

SHRIRAM HOUSING FINANCE LIMITED

Regd. Office: No. 121, Appasa Haldar Street, Chennai - 600011
Branch Office: 403-404, 4th Floor, 3rd Eye Building, Rajiv Gandhi Residency Blue, Panchsheel Cross Road, Colaba, Mumbai - 400005
Amendment No. 001/2020

SYMBOLIC POSSESSION NOTICE

Whereas, the undersigned being the authorized officer of Shriram Housing Finance Limited (SHFL) under the provisions of the Securitisation and Reconstruction of Financial Assets and Enforcement of Security Interest Act, 2002 (said Act) and in exercise of powers conferred under Section 13(1)(2) of the said Act read with Rule 3 of the Security Interest (Enforcement) Rules, 2002 (said Rules) issued demand notices to the borrowers details of which are mentioned in the table below to repay the amount mentioned in the said demand notices. The borrowers having failed to repay the amount, notice is hereby given to the borrowers and the public in general that the undersigned has taken SYMBOLIC possession of the property described herein below in exercise of powers conferred on him under Section 13(4) of the said Act read with rule 8 of the said Rules, on the 7th day of November, 2020.

Borrower Name	Amount due as per Demand Notice	Description of Immovable Property
1. Bharthani Anil Kumar Krishnani, 2. Anil Kumar T. Krishnani	Rs. 8,64,038/- (Rupees Eight Lakh Sixty Four Thousand Thirty Eight Only) as on 10/08/2020	Residential Flat No-A-204, with the measurement of built up area measuring Sq Mtrs 53-05, situated on second floor of "Vishal Residency A" (part-1/Building-5) constructed on land measuring 1719-65 sq.mtrs of plot No 14 to 17 popular area known as "Anjoli Park" of Village - Khirasra, Tal. Ludhika, Dist. Rajkot in the state of Gujarat. Boundaries of the property North: Flat No-A-203 South: Flat No-B-203 East: Star Case Lift and westward Flat No-A-201
3. Anjan Prasad, 4. Jai Ram Plastic, 5. Hitesha Divya Gade	Rs. 2,02,00,000/- (Rupees Two Crore Two Lakh Only) as on 10/08/2020	Plot No. 14 to 17 popular area known as "Anjoli Park" of Village - Khirasra, Tal. Ludhika, Dist. Rajkot in the state of Gujarat. Boundaries of the property North: Flat No-A-203 South: Flat No-B-203 East: Star Case Lift and westward Flat No-A-201

Notice: 10/08/2020
Place: Rajkot
Date: 07.11.2020
Sd/- Authorized Officer
Shriram Housing Finance Limited

